

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન રોમાંચક ઉનાળુ આયોજનો વડે પોતાના બહુવિધ સમુદાયમાં (મોઝેઈક કમ્યુનિટી - Mosaic community) ઉજવણી કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 3, 2019) – સીટી ઓફ બ્રેમ્પટને ઉનાળાની શરૂઆત શ્રેણીબદ્ધ આયોજનો વડે કરી જેની ઉજવણી બ્રેમ્પટનનો વૈવિધ્યસભર સમુદાય કરે છે! સમગ્ર જૂન અને જુલાઈ દરમિયાન આ કૌટુંબિક-અનુકૂળ ઉત્સવો માટે અમારી સાથે જોડાઈ જાવ.

સમુદાયને ઓળખ આપતા આયોજનો (કમ્યુનિટી રેકગ્નિશન ઇવેન્ટ્સ - Community Recognition Events)

ફ્લેગ-રેઈઝીંગ્સ, પરંપરાગત રસોઈકળા અને સાંસ્કૃતિક આયોજનો સમાવતા આ નવા આયોજનો વડે બ્રેમ્પટનના ધનાઢ્ય સાંસ્કૃતિક વૈવિધ્યને લક્ષમાં લો. જૂનમાં એકલા સેલી-બ્રેમ્પટન (CeleBrampton) આયોજનને બદલે, બ્રેમ્પટનના વૈવિધ્યને સન્માન આપવા બ્રેમ્પટન સમગ્ર વર્ષ દરમિયાન નવા અને વિસ્તીર્ણ આયોજનોનું યજમાન બની રહ્યું છે.

રહેવાસીઓ માટે આ ઉજવણીઓ અન્ય સંસ્કૃતિઓ વિશે શીખવાની અને આપણાં શહેરનો ભાગ બનતા ઘણાં સમુદાયોને જાણવાની ચડિયાતી તક છે.

જૂનમાં નીચેના કમ્યુનિટી રેકગ્નિશન ઇવેન્ટ્સ યોજવાના છે:

- **ઈટાલીયન હેરિટેજ મન્થ | જૂન 9 | સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી | ગેંજ પાર્ક**
ઈટાલીયન હેરિટેજ મન્થની (વારસો મહિનાની) ઉજવણી ફ્લેગ-રેઈઝીંગ્સ અને બારબેક્યુ વડે કરો.
- **ફિલિપાઈન હેરિટેજ મન્થ | જૂન 13 | સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી | સીટી હોલ આટ્રિયમ (સ્વાગત કક્ષ)**
પરંપરાગત રસોઈકળાનો નમૂનો, જેમાં પ્રખ્યાત મીઠાઈ હાલો-હાલો સામેલ છે, અને આ પ્રસંગે જીવંત પરફોર્મન્સીસનો (પ્રસ્તુતિઓનો) આનંદ માણો. રહેવાસીઓ અને મુલાકાતીઓને જૂન 11 નાં રોજ સવારે 9 વાગ્યે કેન વ્હિલ્લન્સ સ્કવેરમાં પણ નિમંત્રિત કરવામાં આવે છે જ્યારે અમે ફિલિપાઈન્સના ધ્વજનું ફ્લેગ-રેઈઝીંગ્સ કરીશું.
- **પોર્ટુગીઝ હેરિટેજ મન્થ | જૂન 15 અને 16 | બપોરે 3 થી રાત્રે 11 અને બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી | કેન વ્હિલ્લન્સ સ્કવેર**
બપોરે 3 થી 4 વાગ્યા વચ્ચે સાંસ્કૃતિક રસોઈકળા અને મનોરંજન સાથે ફ્લેગ-રેઈઝીંગ્સ કાર્યક્રમમાં હાજર રહો, ત્યાર પછી જૂન 15 નાં રોજ બપોરે 4 થી રાત્રે 11 વાગ્યા વચ્ચે લુસોફોનિયા ફેસ્ટિવલમાં ભાગ લો. આ ઉત્સવની ઉજવણી જૂન 16 નાં રોજ બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.

ફ્રાન્કી ફ્લોર્સ માર્કેટ ઓપનીંગ ડે (ખેડૂતોનું બજાર ખુલવાનો દિવસ) | જૂન 15 | સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી | મેઈન સ્ટ્રીટ એટ ક્વીન
બ્રેમ્પટનના ખેડૂતોના બજાર ઋતુની શરૂઆત સ્થાનિક ગીતકારો-સંગીતકારો દ્વારા જીવંત સંગીત વડે થશે, કૌટુંબિક પ્રવૃત્તિઓ યોજાશે અને ફ્રેન્કી ફ્લાવર્સ (Frankie Flowers) બગીચાકામ સંબંધિત માહિતી આપશે. રહેવાસીઓ અને મુલાકાતીઓને જૂન 15 થી ઓક્ટોબર 12 સુધી દર શનિવારે સવારે તાજી સ્થાનિક ઊપજ અને હાથબનાવટનો સામાન ઉઠાવવા નિમંત્રિત કરવામાં આવે છે.

નેશનલ ઇન્ડિજનસ પીપલ્સ ડે (રાષ્ટ્રીય સ્વદેશી લોકોનો દિવસ) | જૂન 21 | બપોરે 12:30 થી 2 વાગ્યા સુધી, સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી | ગાર્ડન સ્કવેર

પરફોર્મન્સ (પ્રસ્તુતિ), નૃત્ય, વાર્તા કથન અને ઘણાં બધાં આયોજનો સાથે નેશનલ ઇન્ડિજનસ પીપલ્સ ડે ઉજવો, જેને ઇન્ડિજનીયસ નેટવર્ક પ્રસ્તુત કરશે. પ્રસંગ અને સમુદાયિક પ્રસ્તુતિ બપોરે 12:30 થી 2 વાગ્યા સુધી, ડીજે ક્લાસિક રૂટ્સ (DJ Classic Roots) અને ઇસ્કવી (iskwē) દ્વારા સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

બ્રમ્પટન સેલીબ્રેટ્સ કેનેડા ડે (બ્રમ્પટન કેનેડા દિવસ ઉજવે છે) | જુલાઈ 1 | બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી | ચિંગકુસી પાર્ક કેનેડાના જન્મદિવસે બ્રમ્પટનના વર્ષના સૌથી મોટા તહેવારમાં ભાગ લો! આનંદપ્રમોદ, કૌટુંબિક-અનુકૂળ પ્રવૃત્તિઓ માણો જેમાં ફુગ્ગો ફૂલાવવો (ઈન્ફલેટેબલ્સ), આંતરરાષ્ટ્રીય અવનવી વાનગીઓના વિક્રેતાઓ (ગોરમેટ ફૂડ વેન્ડર્સ) અને ભાષાકાર આતશબાજી શો સામેલ છે, જેની રજૂઆત ટિમ હોર્ટોન્સ (Tim Hortons) કરશે. આ વર્ષની જીવંત મનોરંજન શ્રેણીની ઔપચારિક ઘોષણા માટે સચેત રહો.

પ્રાઈડ ઈન ધી સ્કવેર (સ્કવેરમાં ગૌરવ) | જુલાઈ 7 | બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધી | ગાર્ડન સ્કવેર
બ્રમ્પટનના ગતિશીલ LGBTTIQQ2SA સમુદાયોમાં તમામ ઉંમરના લોકો માટે કળા, પરફોર્મન્સ અને કાર્યક્રમો મારફતે ઉજવાણી કરો. વિવિધ સામુદાયિક પ્રદર્શનકારોને જાણો અને બપોરથી સાંજ સુધી જીવંત મનોરંજનનો આનંદ માણો, જેમાં મુખ્ય પ્રસ્તુતકર્તાઓમાં ટૂ એટેચ્ડ (Too Attached), અને કળાકારો ફે એન્ડ ફ્લફી (Fay & Fluffy), ફ્લાય લેડી ડી (Fly Lady Di) અને ક્વાર્ટરબેક (Quarterback) સામેલ છે.

આ અને અન્ય આગામી આયોજનો પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/events.

અવતરણ (ક્વોટ):

“બ્રમ્પટન પોતાના રહેવાસીઓ અને મુલાકાતીઓના આનંદપ્રમોદ માટે આશ્ચર્યજનક વિવિધ તહેવારો અને પ્રસંગો ઉજવે છે. બ્રમ્પટનની વિવિધતા જાણો, ચડિયાતા ભોજનની મજા માણો, એવોર્ડ વિજેતા મનોરંજનકારો અને ઉદભવતા સ્થાનિક કળાકારો જુઓ, અને આપણાં મોઝેઈક (બહુવિધ સામુદાયિક) શહેર દ્વારા અપાતા બધાં કાર્યક્રમો ઉજવો.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કરી કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca